

સવારે યા સાંજે અકિલા ન્યૂઝ .કોમ

તા. 13 જાન્યુઆરી ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ પોષ વદ - ૧૨ શનિવાર




મુખ્ય સમાચાર

News of Friday, 12th January 2018

GST પરિષદ ઇ-વાહન, સિંચાઈના ઉપકરણોના દરો ઘટાડશે

કૃષિ અને ગ્રામીણ અસ્થવ્યવસ્થાની સાથે સ્વચ્છ ઉરજાને પ્રોત્સાહન આપવા માટે સિંચાઈના ઉપકરણોના દરો ૧૮ ટકાથી ઘટાડી ૧૨ ટકા તો બાયો ડિઝલ અને ઇલેક્ટ્રીક વાહનો પરના દરો ૨૮ ટકાથી ઘટાડી ૧૮ ટકા કરશે; ડિજીટલ કેમેરાના દરો ૨૮ ટકાથી ઘટાડી ૧૮ ટકા કરશે; બજેટ પુર્વે સરકાર ગ્રામીણ, કૃષિ અને નાના એકમોને પ્રોત્સાહન આપવાના પગલા જાહેર કરશે



નવી દિલ્હી તા.૧૨ : જીએસટી પરિષદની આવતા સપ્તાહે યોજનારી પોતાની બેઠકમાં બાયો ડિઝલ બસો, ઇલેક્ટ્રીક વાહનો અને સિંચાઈના કેટલાક ઉપકરણો જેવી કેટલીક વસ્તુઓ પર કરોના દરોમાં ઘટાડો કરી શકે છે. આ પગલાનો હેતુ કૃષિ અને ગ્રામીણ અસ્થવ્યવસ્થાની સાથે જ સ્વચ્છ ઉરજાને પ્રોત્સાહન આપવાનો છે. ૧લી ફેબ્રુઆરીના રોજ રજુ થનારા સામાન્ય બજેટ પહેલા કદાચ જીએસટી પરિષદની આ અંતિમ બેઠક હશે. દરોમાં ઘટાડા માટે અપેક્ષાકૃત નાની યાદીને આ સપ્તાહે ફીટમેન્ટ સમિતિ દ્વારા અંતિમ ઓપ અપાશે. જેના પર કેન્દ્રીય નાણામંત્રી અરૂણ જેટલીના નેતૃત્વવાળી બેઠકમાં નિર્ણય લેવાશે.

આ મામલાથી માહિતગાર એક અધિકારીએ જણાવ્યું છે કે ગ્રામીણ અસ્થવ્યવસ્થા અને સ્વચ્છ ઉરજાને પ્રોત્સાહન આપતી વસ્તુઓને જ પરિષદની આગામી બેઠકમાં દરો ઘટાડવા માટે પસંદ કરવામાં આવી છે. ૨૮ ટકાના કર દાયરાવાળી અન્ય વસ્તુઓ પર આ વખતે વિચાર નહી કરાઈ કારણ કે આવકમાં હજુ સ્થિરતા નથી આવી. સિંચાઈના ઉપકરણોના દરો ૧૮ ટકાથી ઘટાડી ૧૨ ટકા કરવામાં આવશે તો બાયો ડિઝલ અને ઇલેક્ટ્રીક વાહનો પરના દરો ૨૮ ટકાથી ઘટાડી ૧૮ ટકા કરવામાં આવશે.

સેન્ટ્રલ સ્ટેટસ્ટીક ઓફિસ દ્વારા ૨૦૧૮માં કૃષિ ક્ષેત્રનો વિકાસ દર ઘટીને ૨.૧ ટકા રહે તેવું અનુમાન છે. રવિ પાકના ઉત્પાદનમાં ઘટાડાની શક્યતા છે અને ખરીફ પાક ૩ ટકા ઘટવાને કારણે કૃષિ ક્ષેત્રના દેખાવ ઉપર અસર પડે તેવી શક્યતા છે. સુત્રો કહે છે કે જીએસટી પરિષદ કેટલીક ચીજો પર દરો ઘટાડવા વિચાર કરી શકે છે જેમાં કૃષિ ઉપકરણ અને કૃષિ ક્ષેત્ર સાથે સંબંધિત ચીજો ડોચ શકે છે. નવેમ્બરમાં આવક ઘટતા સરકાર દરોમાં ઘટાડાને લઈને વધુ સતર્કતા રાખી રહી છે. સામાન્ય ચૂંટણી પહેલા અંતિમ પુર્ણ બજેટમાં સરકાર ગ્રામીણ, કૃષિ અને નાના એકમોને પ્રોત્સાહન આપવાના પગલાઓ જાહેર કરી શકે છે.

અપ્રત્યક્ષ કરને લઈને નિર્ણય ફવે જીએસટી પરિષદ લ્યે છે. કર્ણાટકે પર્યાવરણ અનુકુળ બાયો ડિઝલ બસોને પ્રોત્સાહન આપવાનુ શરૂ કર્યું છે. નિગમે કેટલીક બસો પણ શરૂ કરી છે. પરિષદ ડિજીટલ કેમેરાના દર રૂટ ટકાથી ઘટાડી ૧૮ ટકા કરવા વિચાર કરી શકે છે. નિકોન, કેનન અને સોની જેવી કંપનીઓએ સ્માર્ટ ફોનથી મળતી આકરી પ્રતિસ્પર્ધા વચ્ચે ઉદ્યોગની વચ્ચે દરો ઘટાડવાની માંગણી કરી છે.

(10:07 am IST)